

ત્વરિત જાહેરાત માટે

સીટી ઓફ બ્રેમ્પટન વર્લ્ડ કાઉન્સિલ ઓન સીટી ડેટાનું પ્લેટિનમ-સ્તરનું ISO ડેટા સર્ટિફિકેશન સતત બીજા વર્ષે મેળવે છે

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (ઓક્ટોબર 13, 2021) – આજે, વર્લ્ડ કાઉન્સિલ ઓન સીટી ડેટા (WCCD) દ્વારા ઘોષણા કરવામાં આવી કે સીટી ઓફ બ્રેમ્પટનને સતત બીજા વર્ષ માટે, ISO 37120 પ્લેટિનમ-સ્તરનું સર્ટિફિકેશન મળે છે, જે અસરકારક રીતે નિર્ણયો લેવા ડેટા એકત્રીકરણ, વહેંચણી, અને ડેટાને ઉપયોગમાં લેવામાં ઉચ્ચતમ ધોરણ દર્શાવે છે.

સીટીએ WCCD નાં ISO 37120 ધોરણમાં 104 માંથી 90 થી વધારે સૂચકાંકો નોંધાવીને ઉચ્ચતમ-સ્તર માટેની જરૂરિયાત સંતોષી છે, જે ગવર્નમેન્ટ ઓફ કેનેડા સહાયક [ડેટા ફોર કેનેડિયન સીટીસ પ્રોજેક્ટ \(DCCP\)](#) નો ભાગ છે, અને 35 દેશોમાંના 100 થી વધારે વૈશ્વિક શહેરોના પસંદગીના સમૂહમાં – અને કેનેડામાં 30 માં જોડાય છે – જે અસરકારક અને પરિવર્તનશીલ નિર્ણયો લેવા સીટીનો ડેટા એકઠો કરે છે, વહેંચે છે, અને ઉપયોગમાં લે છે.

સીટી WCCD ગ્લોબલ નેટવર્કના સભ્ય તરીકે, સેવાઓની અને રહેવાસીઓના જીવનની ગુણવત્તા સુધારવા દુનિયાભરના અન્ય ડેટા-ચલિત શહેરોની સામે પોતાના સ્થાનિક અનુભવો અને બેંચમાર્ક્સ (આધાર-ચિહ્નરૂપી) માહિતી વહેંચે છે. બ્રેમ્પટન પોતાના WCCD ગ્લોબલ નેટવર્ક ભાગીદારોની સાથે, એક સ્માર્ટ, ટકાઉ, લચીલો, સમૃદ્ધ અને સર્વગ્રાહી સમુદાય બનાવવાનું ચાલુ રાખવા સામાજિક, આર્થિક અને પર્યાવરણલક્ષી સૂચકાંકો માપશે.

વર્લ્ડ કાઉન્સિલ ઓન સીટી ડેટા (WCCD) અને સર્ટિફિકેશન વિશે વધુ માહિતી માટે વેબસાઇટ જુઓ, www.dataforcities.org.

ડેટા ફોર કેનેડિયન સીટીસ પ્રોજેક્ટ વિશે

સમગ્ર કેનેડાના શહેરી આગેવાનોને ઉચ્ચ-માત્રાના, સરખામણી યોગ્ય, અને સ્વતંત્ર રીતે ચકાસેલા મ્યુનિસિપલ ડેટા વડે સજ્જ કરીને, [ડેટા ફોર કેનેડિયન સીટીસ પ્રોજેક્ટ](#) એક પરિવર્તનશીલ, ત્રણ-વર્ષીય, સમગ્ર કેનેડાને આવરી લેતો પ્રોજેક્ટ છે જે હાલમાં દેશભરની પંદર જેટલી ડેટા-ચલિત મ્યુનિસિપાલિટીસમાં ચાલી રહ્યો છે. ફેડરલ મિનિસ્ટ્રી ઓફ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ કમ્યુનિટીસની સહાયતા મેળવીને, આ પ્રોજેક્ટ શહેરી આગેવાનો માટે તેઓ દ્વારા મહત્વના નિર્ણયો લેવા જરૂરી પ્રકારનો ડેટા પૂરો પાડે છે, પણ સમગ્ર કેનેડાના ત્રીસ શહેરો, અને દુનિયાભરના 100 શહેરો સાથે મજબૂત, સંપૂર્ણ સરખામણીઓ કરતી વખતે, આંતરિક બેંચમાર્કિંગ પણ મજબૂત બનાવે છે. સ્થિરતા આયોજન મજબૂત કરવાથી માંડીને આબોલવામાં ફેરફાર લેતુઓ સિદ્ધ કરવા આર્થિક વિકાસ ચલિત કરવા, અને નિર્ણાયક રોકાણ નિર્ણયો જાણાવવા, ડેટા ફોર કેનેડિયન સીટીસ પ્રોજેક્ટ દેશભરના મ્યુનિસિપલ નિર્ણાયકોને સ્માર્ટર, વધારે ટકાઉ, લચીલા, સમૃદ્ધ અને સર્વગ્રાહી સમુદાયો બનાવવા જરૂરી અનિવાર્ય ડેટા આપે છે.

ક્વોટ્સ (અવતરણો)

“બ્રેમ્પટન એક સુસંચાલિત શહેર છે, અને અમે એક સર્વગ્રાહી સમુદાય બનાવી રહ્યાં છીએ જે સુરક્ષિત, ટકાઉ અને સફળ રહે. ડેટા-ચલિત નિર્ણય પ્રક્રિયા કરીને, અમે અમારા રહેવાસીઓ માટે જીવનની ગુણવત્તા સુધારવાનું ચાલુ રાખીએ છીએ. અમે સતત બીજા વર્ષ માટે WCCD દ્વારા ISO 37120 પ્લેટિનમ-સ્તરના સર્ટિફિકેશન તરીકે ઓળખ મળવા બદલ ગૌરવ અનુભવીએ છીએ, અને WCCD ગ્લોબલ નેટવર્ક સાથે અમારા સ્થાનિક અનુભવો વહેંચવા, તેમજ અન્ય શહેરો પાસેથી શિક્ષણ મેળવવા આશાવાદી છીએ, જેથી અમારા રહેવાસીઓ અને સમગ્ર કેનેડાવાસીઓને લાભ મળી શકે.”

- પેટ્રિક બ્રાઉન (Patrick Brown), મેયર, સીટી ઓફ બ્રેમ્પટન

“આપણાં રહેવાસીઓ માટે અસરકારક નિર્ણયો લેવા ડેટા હોવો અનિવાર્ય છે, અને શ્રેષ્ઠ WCCD ગ્લોબલ નેટવર્કના ભાગ તરીકે પસંદગી પામીને, અમે અન્ય ડેટા-ચલિત સમુદાયો સાથે સહયોગ સાધીને તેઓ પાસેથી બેચમાર્ક (આધાર-ચિલ્નરૂપી) માહિતી શીખી શકીએ છીએ, જેથી બ્રેમ્પટનવાસીઓ અને સમગ્ર કેનેડાના લોકોનું જીવન સુધારી શકાય. સીટી ઓફ બ્રેમ્પટન સતત બીજા વર્ષ માટે વર્લ્ડ કાઉન્સિલ ઓન સીટી ડેટા પાસેથી ઓળખ મળવા બદલ ગૌરવ અનુભવે છે, અને પુરાવો-આધારિત નિર્ણય-પ્રક્રિયા કરીને આપણી સ્થિરતા અને માળખાગત સગવડ સુધારવાનું અને આર્થિક વિકાસ ચલિત કરવાનું ચાલુ રાખશે.”

- હરકિરત સિંહ (Harkirat Singh), અધ્યક્ષ, કોર્પોરેટ સેવાઓ; સીટી કાઉન્સિલર, વોર્ડ્સ 9 અને 10, સીટી ઓફ બ્રેમ્પટન

“સીટી ઓફ બ્રેમ્પટન કાઉન્સિલની અગ્રતાની પરિભાષાને આગળ વધારવા સમર્પિત છે: બ્રેમ્પટન એક સુસંચાલિત શહેર છે, અને – WCCD પાસેથી સતત બે વર્ષથી ISO 37120 પ્લેટિનમ-સ્તરનું સર્ટિફિકેશન મળવાના પુરાવા તરીકે – આપણને નવીન શોધ અને ડેટા ચલિત નિર્ણય પ્રક્રિયામાં વૈશ્વિક અગ્રણી તરીકે ઓળખ મળવાનું ચાલુ છે. આપણી ટીમ આપણાં રહેવાસીઓ માટે સુરક્ષિત, ટકાઉ અને સફળ શહેર બનાવવા સતત પ્રયત્નશીલ છે, અને અમે તે કરવા સહયોગ માટે અને પુરાવો-આધારિત નિર્ણયો લેવા અમારી ભાગીદારીઓનો લાભ લેવાનું ચાલુ રાખીશું.”

- ડેવિડ બારિક (David Barrick), ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, સીટી ઓફ બ્રેમ્પટન

“WCCD વતી, સીટી ઓફ બ્રેમ્પટનને તેઓના ઉચ્ચતમ, પ્લેટિનમ સ્તરે WCCD ISO 37120 સર્ટિફિકેશનના બીજા વર્ષે અભિનંદન આપવામાં હું ખુશી અનુભવું છું. બ્રેમ્પટન પ્રમાણભૂત સીટી ડેટા ઉપયોગમાં લેવાની પોતાની કટિબદ્ધતામાં વૈશ્વિક સ્તરે 100 ઉપરાંત WCCD શહેરોના સમૂહમાં અડીખમ ઊભું છે જેથી બધાં બ્રેમ્પટનવાસીઓ માટે બહુ ટકાઉ, લચીલા, સમૃદ્ધ, સર્વગ્રાહી અને સ્માર્ટ ભાવિ તરફ આગળ વધી શકાય. ડેટા ફોર કેનેડિયન સીટીસ પ્રોજેક્ટના ભાગરૂપે આ ઉપલબ્ધિ પર મેયર બ્રાઉન (Brown), મુખ્ય વહીવટી અધિકારી ડેવિડ બારિક (David Barrick), કાઉન્સિલ અને કર્મચારીઓને અભિનંદન. તમે આ વાર્ષિક ડેટાનો ઉપયોગ તમારા શહેરવાસીઓ માટે ફેરફારને ચલિત કરવા અને તમારી અપવાદમય પ્રગતિની દેખરેખ રાખવા ડેટા નોંધવાનું ચાલુ રાખ્યું છે ત્યારે WCCD તમારી સાથે કામ કરવામાં સાથે છે.”

- ડૉ. પેટ્રિશિયા મેકકાર્ની (Dr. Patricia McCarney), પ્રમુખ અને CEO, WCCD

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 7,00,000 કરતા વધુ લોકો વસે છે અને તેમાં 75,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. વધુ જાણવા માટે www.brampton.ca.

મિડિયા સંપર્ક :

મોનિકા ડુગ્ગલ (Monika Duggal)

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ (Strategic Communication)

સીટી ઓફ બ્રેમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca